

એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજનામાં અરજી કરતા પહેલા ધ્યાને રાખવાના મુદ્દા

- વિદ્યાર્થી દ્વારા ધોરણ-૧૨ની પરીક્ષા ૬૦% કે તેથી વધુ પર્સેન્ટાઈલ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
- વિદ્યાર્થીના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
- વિદ્યાર્થી દ્વારા ધોરણ-૧૨ની પરીક્ષા આપેલ ન હોય તો તેવા વિદ્યાર્થીઓએ ડીપ્લોમાંના આધારે અરજી કરવાની રહેશે. ડિપ્લોમામાં ૬૦ કે તેથી વધુ પર્સનટેજ મેળવેલ હોવા જોઈએ.
- ગુજરાત રાજ્યના માન્ય બોર્ડ અથવા માન્ય કેન્દ્રીય બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષા પસાર કરીને દેશ અને વિદેશની માન્ય યુનિવર્સિટીની કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.
- અભ્યાસક્રમ અર્થે લીધેલ લોનનો ઉપાડ ઠરાવની તારીખ:-૦૪/૦૭/૨૦૧૭ પછી કરેલ હોવો જોઈએ.
- એજ્યુકેશન લોન શિડયુલ બેંકમાંથી જ લીધેલ હોવી જોઈએ.(શિડયુલ બેંકમાં કઈ-કઈ બેંકનો સમાવેશ થાય છે તેની વિગત વેબસાઈટ પર આપેલ છે)
- વિદ્યાર્થી દ્વારા અભ્યાસ માટે લીધેલી લોન પૈકી રૂ.૧૦ લાખ સુધીની લોન પરનું માત્ર વ્યાજ મોરેટોરીયમ પિરિયડ સુધી વિદ્યાર્થીના લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવશે, જો વિદ્યાર્થી દ્વારા વર્ષ દરમિયાન નિયમિત રીતે વ્યાજની રકમ બેંકમાં ચૂકવેલ હશે તો બેંક પાસેથી તે અંગે પત્રક મંગાવ્યા બાદ જ વિદ્યાર્થીને વ્યાજ સહાય તેના બચત ખાતામાં આપવામાં આવશે.
- તમામ બેંક દસ્તાવેજોમાં બેંક મેનેજર દ્વારા સહી અને સિક્કા કરેલ હોવા જરૂરી છે. જો બેંક દ્વારા સહી-સિક્કા કરેલ નહીં હોય તો તે દસ્તાવેજ માન્ય ગણાશે નહીં.
- વ્યાજ માફી નાણાકીય વર્ષના અંતે આપવામાં આવશે.
- વિદ્યાર્થીને આર.બી.આઈ.ની ગાઈડલાઈન પ્રમાણે માત્ર સાફ વ્યાજ ચુકવવામાં આવશે. બેંકો દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ, અન્ય કોઈપણ પરચુરણ ચાર્જ, અન્ય ફી કે પેનલ્ટી લેવામાં આવી હશે તો તે ચુકવવામાં આવશે નહીં.
- જો કોઈ વિદ્યાર્થીના વાલીની એક નાણાકીય વર્ષ માટે આવક ૬ લાખ કરતા વધુ હોય અને અરજી નામંજૂર થઈ હોય કે અરજી કરેલ ન હોય તેઓની જો પછીના નાણાકીય વર્ષમાં આવક ૬ લાખ કરતા ઓછી હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે.
- આ યોજનામાં લોન આપવાની કોઈ વ્યવસ્થા નથી, તેથી લોનની માંગણી કરવી નહીં.
- અરજી કેવી રીતે કરવી તેની વિગત “How to Apply” પરથી મળશે.

- અરજદારે કેસીજીની વેબસાઈટ પર મુકવામાં આવેલ અરજીપત્રક ઓનલાઈન ભરીને એકનોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ લઈ એકનોલેજમેન્ટ રીસીપ્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડી કેસીજી કચેરીમાં જમા કરવાના રહેશે. જોડવાના થતા દસ્તાવેજોનું લીસ્ટ વેબસાઈટ પર આપેલ છે. અધૂરા દસ્તાવેજો વાડી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
- અરજદારને દસ્તાવેજોની ચકાસણી માટે જ્યારે પણ રૂબરૂ બોલાવામાં આવે ત્યારે ઉપસ્થિત રહેવું આવશ્યક છે.
- જો વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરતો હોય અને વિદ્યાર્થીએ તેના વતી વિવિધ દસ્તાવેજોમાં સહી કરવા તેના માતા/પિતા પૈકી જે ને પણ ઓથોરીટી આપી હોય તો તે પાવર ઓફ એટર્ની માન્ય ગણવામાં આવશે અને વિદ્યાર્થી વતિ માતા અથવા પિતા જ સહી કરી શકશે કે રજૂઆત કરી શકશે અન્ય કોઈને ઓથોરીટી આપી હશે તો માન્ય ગણવામાં આવશે નહીં.
- તમામ દસ્તાવેજો સેલ્ફ અટેસ્ટેડ હોવા જોઈએ અને “Checklist for Document” પ્રમાણે ક્રમમાં હોવા જોઈએ. (સેલ્ફ અટેસ્ટેડ દસ્તાવેજો રજૂ કરી ન શકે તેમ હોય તો પ્રમાણિત નકલ(True Copy) રજૂ કરવાની રહેશે)
- મોરેટોરીયમ પીરીયડ અનુસાર વ્યાજ માફી અભ્યાસક્રમ પૂરો થયા પછી એક વર્ષ સુધી ચાલુ રહેશે.
- વિદ્યાર્થી જો નાપાસ થાય, અભ્યાસ છોડી દે, લોનની ભરપાઈ કરી દે કે બેંક જાતે જ લોન રદ કરે તો વ્યાજ સબસીડી બંધ કરવામાં આવશે.
- ભારત સરકાર,ગુજરાત સરકાર કે સરકાર હસ્તકની અન્ય સંસ્થાઓ પાસેથી સ્કોલરશીપ, શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી કે અન્ય કોઈપણ યોજનાનો લાભ લીધેલ હશે તો આ લાભ મળવાપાત્ર થશે નહીં.
- વ્યાજ માફીનો લાભ મળ્યાબાદ રીન્યુઅલમાં ક્યા દસ્તાવેજો જમા કરાવવા તેની વિગત પણ વેબસાઈટ પર આપેલ છે.

ઉમેદવારને અરજીપત્રક ભરવામાં કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો હેલ્પ લાઈન નંબર ૯૯૦૯૦૩૯૩૮૦ અને Email ID:- isel-kcg@gujgov.edu.in પર સવારે ૧૦:૩૦ થી ૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૬:૦૦ સુધી સંપર્ક કરી શકશે.(રવિવાર અને જાહેર રજાના દિવસે હેલ્પલાઈન નંબર બંધ રહેશે)